

Pradhan Mantri Kisan SAMman Nidhi (PM-KISAN)

માર્ગદર્શિકા સારાંશ*

યોજનાનો મુખ્ય હેતુ નાના અને સિમાંત પરિવારને આવકમાં વધારો કરી આર્થિક સહાય પુરી પાડવાનો છે.

૨.૨.(એ) કુલ બે લેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક રૂ ૬ લાખ ત્રણ સરખા હપ્તામાં દર ચાર માસે ચુકવવામાં આવશે.

૨.૨ (બી) પહેલો હપ્તો તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ માટે ચુકવવાનો રહેશે.

૨.૩ પતિ, પત્નિ અને સગિર બાળકો નો એક પરિવાર ગણવામાં આવશે અને તે તમામ સભ્યોની રેવન્યુ રેકર્ડ મુજબ ધારણ કરેલ કુલ જમીન એકત્રીત કરતા બે લેક્ટર કરતા ઓછી કુલ જમીન થતી હોય તે નાના અને સિમાંત જમીન ધારક પરિવારની વ્યાખ્યામાં આવે છે.

૨.૪ સંસ્થાકીય ખાતેદારો અને નિચે મુજબના ખાતેદારોને આ યોજના હેઠળ સહાયથી બાકાત રાખવાના રહેશે.

ખેડૂત પરિવાર કે જેના કોઈ એક અથવા વધુ સભ્યો નિચની વિગત માં સમાવેશ થતો હોય

- વૈધાનિક પદ ધરાવતા હોય
- ભુતપુર્વ કે ચાલુ મંત્રીશ્રી/ રાજ્ય મંત્રીશ્રી/ ચાલુ સાંસદશ્રી/ ચાલુ ધારાસભ્યશ્રી / ભુતપુર્વ અને ચાલુ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી/ ભુતપુર્વ અને ચાલુ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી
- વર્ગ ચાર સિવાયના અને ખાનગી સંસ્થાઓ સિવાયના તમામ કર્મચારીઓ
- છેલ્લા વર્ષે આવક વેરો ભરેલ વ્યક્તિઓ
- ડોક્ટર, એજીનીયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ

૨.૪.૨ આ યોજના હેઠળ બાકાત રાખવાના કિસ્સામાં અરજદરના કબુલાતનામાના આધારે આ યોજનાનો લાભ આપી શકાશે અને ખોટી વિગત આપવા માટે જે તે લાભાર્થી જવાબદાર રહેશે અને તેના વિરુદ્ધ રીકવરી અને અન્ય તમામ કાયદાકીય પગલા લઈ શકાશે.

૩.૨ જો એક ખેડૂત ખાતેદાર પરિવાર એક કરતા વધુ રેવન્યુ એકમોમાં જમીન ધરાવતા હશે તો તે તમામનો સરવાળો કરી પાત્રતા નક્કી કરવાની રહેશે.

સંયુક્ત ખાતેદારો પૈકી સહુથી વધુ જમીન ધરાવતા સભ્યના બેંક ખાતામાં અને એક કરતા વધુ સભ્યો સરખી ભાગે જમીન ધારણ કરતા હોય તો સહુથી વરિષ્ઠ સભ્યના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરવાની રહેશે.

૩.૩ આ યોજનાની કટઓફ તારીખ ૦૧/૦૨/૨૦૧૯ રહેશે અને ત્યારબાદ ૫ વર્ષ સુધે લાભાર્થીમાં ફેરફાર થશે નહીં.

૩.૪ જમીન ધારકના મૃત્યુથી વારસાઈના કિસ્સામાં લાભાર્થી ફેરવી શકાશે. જે કિસ્સામાં જમીનની ખરીદી, ભેંટ, વસિયતનામાના વગેરેના કારણે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૧/૨૦૧૯ સુધીમાં ખાતેદારનું નામ ફેરવેલ છે તેમને જે-તે તારીખથી સપ્રમાણ લાભ આપવાનો રહેશે.

૪.૧ રાજ્ય દ્વારા નામ, ઉમર, લીંગ, SC/ST, આધાર નંબર, બેંક ખાતા નંબર, મોબાઈલ નંબર વગેરે મેળવી તેનો ડેટાબેઝ બનાવવાનો રહેશે. ડુબલિકેટ ચુકવણુ ન થાય તે માટે રાજ્ય સરકારે તમામ તકેદારી રાખવાની રહેશે.

૪.૨ લાભાર્થી પાસે આધાર નંબરનો ઉપયોગ અને ખાતરી કરવા માટે સંમતી મેળવવાની રહેશે.

૪.૩ રાજ્યની હયાત જમીન ધારકતા રેકર્ડના આધારે લાભાર્થી પસંદ કરવાના રહેશે.

૪.૪ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી ગ્રામ્ય કક્ષાએ પ્રસિધ્ધ કરવાની રહેશે. જે નાના / સિમાંત ખેડૂત પરિવારને લાભ થી વંચીત રહેલ છે તેમને એક વખત સુનવાણીની તક આપવાની રહેશે.

૫.૧ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાની રીવ્યુ કમીટીની જાહેર કરવામાં આવશે.

૫.૨ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાની ફરીયાદ નિવારણ સમીક્ષા સમિતીનું ગઠન કરવામાં આવશે અને ફરીયાદોનો નિકાલ બે અઠવાડીયામાં કરવાનો રહેશે.

૭.એ. <http://pmkisan.nic.in> પોર્ટલ બનાવવામાં આવનાર છે.

૭.સી તાલુકો, ગામ, ખેડૂતનું નામ, આધાર નંબર, લીંગ, કેટેગરી, ifsc કોડ અને બેંક ખાતા ક્રમાંકની વિગત ફરજિયાત છે. વૈકલ્પિક વિગતો વહીવટી સરળતા ખાતર લેવાની રહે છે.

ડીજિટલી ઉપલબ્ધ અને શક્ય હશે તે વિગતો pmkisan પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે તે સિવાયની વિગતો ઓનલાઇન કરવાની રહેશે.

૭.ડી તાલુકા લેવલના યુઝર આઈડીથી ખેડૂતનું નામ આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે પરથી શોધવા માટેની સુવિધા ઉપલબ્ધ હશે. ઘટતા નામો જોડી શકાશે.

તાલુકા / જિલ્લા કક્ષાએથી ડેટા ઈ-સાઈન કરવાનો રહેશે. બાકાત રાખવાના ખેડૂતોની યાદી ધ્યાન પર લેવી અગત્યની છે.

૮.૧ જિલ્લાવાર લાભાર્થીની પ્રમાણિત યાદી પોર્ટલ પર અપલોડ થયેથી MNREGS પેટર્ન પર આધાર લીંક બેંક એકાઉન્ટ પર ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર થી સીધું કેંદ્ર સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવશે.

૮.૧ બી રાજ્ય સરકાર દ્વારા કરવાના થતા કાર્યો:

- પાત્રતા ધરાવત ખેડોત પરિવારની ઓળખ કરી તેની વિગતો પોર્ટલ પર અપલોડ કરવી
- દરેક વિગતોની ચકાસણી જરૂરી સુધારા કરવા

૮.૨ લાભાર્થીની યાદી પંચાયત સ્તર પર પ્રદર્શિત કરવાની રહેશે. સહાય બાબતની જાણ sms દ્વારા કરવાની રહેશે. દરેક ફરીયાદનું નિવારણ સત્વરે કરવાનું રહેશે અને દર વર્ષે ૫% લાભાર્થીની ચકાસણી કરવાની રહેશે.

૮.૧ તારીખ ૨૫ ફેબ્રુઆરી પહેલા તમામ લાભાર્થીની યાદી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

૧૦.૧ લાભાર્થીની યાદી એક વર્ષ માટે માન્ય રહેશે અને રાજ્ય સરકાર દ્વારા જમીનધારકતામાં ઉત્તરોત્તર ફેરફારના કારણે પાત્રતા ધરાવતા વધુ લાભાર્થી યાદીમાં નિયમાનુસાર જોડી શકાશે.

વિગત	વાર્ષિક સહાય પાત્રતા
એક ખેડૂત પરિવાર દ્વારા ૧૦ હેક્ટર જમીન ધારણ કરેલ છે	કોઈ લાભ નહીં
પાંચ ખેડૂત પરિવાર દ્વારા ૧૦ હેક્ટર જમીનમાં થી દરેક બે હેક્ટર જમીન ધારણ કરેલ છે	દરેક પરિવારને રૂ. ૬૦૦૦/-
૧૬ હેક્ટર જમીન ધારણકર્તા ૧૨ પરિવારો પૈકી ૪ પરિવાર ૧ હેક્ટર જમીન ધારણ કરે છે અને ૮ પરિવાર ૧.૫ હે. જમીન ધારણ કરે છે.	દરેક પરિવારને રૂ. ૬૦૦૦/-
એક પરિવારના અલગ-અલગ સભ્યો દ્વારા અલગ-અલગ રેવન્યુ એકમોમાં ૧.૮ હે. જમીન ધારણ કરેલ છે.	વાર્ષિક રૂ. ૬૦૦૦/- (દરેક પરિવારને રૂ. ૬૦૦૦/- માર્ગદર્શિકા મુજબ)
૧૦ હેક્ટર જમીન ૪ પરિવાર દ્વારા ધરાવતા હોવાના કિસ્સામાં ૧ પરિવાર પાસે ૪ હે જમીન છે જ્યારે અન્ય ત્રણ પાસે ૧.૫ હેક્ટર જમીન છે.	૪ હેક્ટર જમીન ધરાવતા પરિવારને- કોઈ લાભ નહીં અન્ય ૩ પરિવારને રૂ. ૬૦૦૦૦/-
જો જમીનની માલિકી ૫ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ વારસાઈ / વેંચાણના કારણે ફેરફાર થયેલા હોય	સપ્રમાણ લાભ (બે મહીના અને પચીસ દિવસ માટે સહાય મળવાપાત્ર)

- આ માત્ર તાલીમ અને સમાજના આપવા મટે માર્ગદર્શિકા સારાંશ છે. કોઈ પણ સ્પષ્ટતા કે વિવાદ માટે સરકારશ્રીની અંગ્રેજી માર્ગદર્શિકાનો ઉપયોગ કરવો.